



Price ₹ 5/-

મારું હદ્ય

વર્ષ-૧૦, અંક-૧૧૪, ૧૫ જૂન, ૨૦૧૬

કાર્ડીઓઝસ્ટ

| | | | |
|-------------------|-----------------|-------------------|-----------------|
| ડૉ. સત્ય ગુપ્તા | +૯૧-૮૮૨૪૦ ૪૫૭૮૦ | ડૉ. મિલન ચગ | +૯૧-૮૮૨૪૦ ૨૨૧૦૭ |
| ડૉ. વિનીત સાંખલા | +૯૧-૮૮૨૪૦ ૧૫૦૫૬ | ડૉ. ઉમ્રિલ શાહ | +૯૧-૮૮૨૪૦ ૬૬૮૮૮ |
| ડૉ. વિપુલ કપૂર | +૯૧-૮૮૨૪૦ ૮૮૮૮૮ | ડૉ. હેમાંગ બકી | +૯૧-૮૮૨૪૦ ૩૦૧૧૧ |
| ડૉ. તેજસ વી. પટેલ | +૯૧-૮૮૪૦૩ ૦૫૧૩૦ | ડૉ. અનિશ ચંદ્રાણા | +૯૧-૮૮૨૪૦ ૮૬૮૮૨ |
| ડૉ. ગુણવંત પટેલ | +૯૧-૮૮૨૪૦ ૬૧૨૬૬ | ડૉ. અભ્યન્થ નાઈક | +૯૧-૮૮૨૪૦ ૮૨૬૬૬ |
| ડૉ. કેપૂર પરીખ | +૯૧-૮૮૨૪૦ ૨૬૮૮૮ | | |

પીડિયાટ્રીક કાર્ડીઓઝસ્ટ

| | | | |
|-------------------------|-----------------|-------------|-----------------|
| ડૉ. કશ્યપ શેઠ | +૯૧-૮૮૨૪૦ ૧૨૨૮૮ | ડૉ. મિલન ચગ | +૯૧-૮૮૨૪૦ ૨૨૧૦૭ |
| ડૉ. ટિલ્યેશ સાંદ્રીવાળા | +૯૧-૮૨૩૮૩ ૩૬૬૮૦ | | |

કાર્ડીએક સર્જન

ડૉ. ધીરન શાહ +૯૧-૮૮૨૪૦ ૭૫૮૭૩

ડૉ. ધવલ નાયક +૯૧-૮૦૮૮૨ ૧૧૧૩૩

ડૉ. અમિત ચંદ્ન +૯૧-૮૬૮૮૦ ૮૪૦૬૭

પીડિયાટ્રીક અને સ્રોક્યર્લ હાર્ટ સર્જન

ડૉ. શૈનક શાહ +૯૧-૮૮૨૪૦ ૪૪૫૦૨

કાર્ડીઓસ્ક્યુલાર, થોરાસીક અને

થોરાકોસ્કોપીક સર્જન

ડૉ. પ્રાણ મોદી +૯૧-૮૮૨૪૦ ૮૪૭૦૦

કાર્ડીએક એનેસ્થેટિસ્ટ

ડૉ. નિરેન ભાવસાર +૯૧-૮૮૭૭૫ ૭૧૮૧૭

ડૉ. લિલન ધોળકિયા +૯૧-૮૪૮૬૩ ૭૫૮૧૮

ડૉ. ચિંતન શેઠ +૯૧-૮૧૭૩૨ ૦૪૪૪૪

કાર્ડીએક ઇલેક્ટ્રોફિઝિયોલોજસ્ટ

ડૉ. અભ્યન્થ નાઈક +૯૧-૮૮૨૪૦ ૮૨૬૬૬

ડૉ. વિનીત સાંખલા +૯૧-૮૮૨૪૦ ૧૫૦૫૬

નીઓનેટોલોજસ અને પીડિયાટ્રીક ઇન્ટેન્સીવીઝ

ડૉ. અમિત ચિંતન શેઠ +૯૧-૮૦૮૮૮ ૮૪૮૦૦



CARE INSTITUTE OF MEDICAL SCIENCES

Earning Trust with World-Class Practices

રંધાયેલી નળીઓનું પરિણામ - હાર્ટ એટેક

આપણે જોયું કે ધમનીઓ કઈ રીતે કઠણ થઈ જાય છે અને તેમાં અવરોધ આવી જાય છે. તે અવરોધના કારણે એનજાયના પેક્ટોરિસ અને તેના પછી હૃદયરોગનો હુમલો આવે છે. (અને એક્યૂટ માયોકાર્ડિયલ ઈન્જાર્ક્શન કહેવાય છે.)

જ્યારે હૃદયને લોહી ઓછું પહોંચે છે, ત્યારે ખરેખર શું થાય છે? જો થોડું પણ લોહી મળતું હોય તો દર્દને છાતીમાં તીવ્ર દુઃખાવો અને ગભરામણ થાય છે. આ સ્થિતિને ‘અસ્થિર એનજાયના’ કહેવાય છે. જો લોહી મળતું તદ્દન બંધ થઈ જાય, તો હૃદયના જે ભાગને તે અવરોધવાળી ધમની દ્વારા લોહી મળતું હોય તે ભાગ હંગામી ધોરણે મૂલ્ય જ પામે છે, એટલે કે હૃદયના તે ભાગમાંથી ચેતન જતું રહે છે અને તે પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે છે. આને હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) કહેવામાં આવે છે.


આશ્રયજનક વાત એ છે કે આ બહાદુર અવયવ હજુ પણ લોહી પંપ કરવાનું ચાલુ રાખે છે, પણ ઓછી ક્ષમતાથી. આ હૃદયરોગના હુમલા પછી તરતનો સમય બાહુદાર કટોક્ટીનો હોય છે. જો હુમલા પછીના 6થી 12 કલાકમાં યોગ્ય સારવાર આપવામાં આવે, તો હૃદયના જે ભાગને લોહી ન મળવાથી નુકસાન થયું હોય, તે

ભાગ ફરીથી કાર્યરત થઈ શકે. આથી હૃદયરોગના હુમલા પછી તાત્કાલિક સારવાર કરવી જોઈએ. હૃદયરોગના તીવ્ર હુમલા વખતે તાત્કાલિક સારવાર ઘણી વાર દર્દને જ્યનદાન અર્પે છે.

હૃદયરોગના હુમલાની ચેતવણીનાં ચિહ્નો

હૃદયરોગના અમુક હુમલા અચાનક અને તીવ્રતાથી આવે છે, પણ મોટાભાગના હૃદયરોગના હુમલા ધીમે રહીને ચાલુ થાય છે અને તેમાં ધીમો દુઃખાવો અથવા ધીમી ગભરામણ થાય છે. આ છે સૌથી સામાન્ય લક્ષણો અને ચિહ્નોમાંનાં થોડાં :

નીચેના તીર બતાવે છે કે હૃદયની જે ધમની બંધ થઈ હોય એ પ્રમાણે હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચે છે.



હાર્ટએટેકથી હૃદયને જુદી જુદી જગ્યાએ નુકસાન થાય છે.

■ છાતીમાં ગભરામણ : છાતીના વચ્ચા ભાગમાં ગભરામણ, જે થોડીક મિનિટોથી વધારે લાંબી ચાલે અથવા તો બંધ થઈ જાય. તેનથી અરુંધિ પેદા કરતું વજન, દબાગ, ભરાવા અથવા દુઃખાવા જેવું મહેસૂસ થાય.

■ અન્ય ભાગમાં બેચેની : આમાં એક અથવા બન્ને બાવડાં, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુઃખાવો અથવા બેચેનીનો સમાવેશ થાય છે.

■ શ્વાસ લેવામાં તકલીફ થવી : આ તકલીફ અનેક વખત છાતીમાં ગભરામણ થવાની સાથે થાય છે, પણ તે ગભરામણ થતા પહેલાં પણ થાય થઈ શકે.

■ અન્ય લક્ષણો : જેમાં હંડો પસ્સીનો છૂટવો, મોળ ચડવો, અથવા મગજ ખાલી-ખાલી લાગવું તેનો સમાવેશ થાય છે. જેલ્ટી પણ થાય છે.

| | |
|--|--|
| ટુંડ્રા : પુરુષ | ટુંડ્રા ૪૫ વર્ષ કે તેથી વધારે |
| ટુંડ્રા : સ્ત્રી | ટુંડ્રા ૫૫ વર્ષ કે તેથી વધારે અથવા પ્રિમેન્યુર મેનોપોઝ |
| હૃદયના રોગનો ક્ષેત્રબિક ડાનિયલસ | નાની ટુંડ્રા હૃદયની ધમનીનો રોગ |
| તમાકુનું સેવન અથવા (ધૂખ્યપાન) | શેટ્ટાં વધારે ધૂખ્યપાન અથવા ગુટાનું સેવન તેમ વધારે ઓખમ |
| લોહીનું જુદી ટ્યાંકા | સાચવાર કર્યા વિના એચ.બી.પી. કેમ લાંબા સમય સુધી, તેમ ઓખમ વધુ |
| લોહીમાં ચરબીનું વધારે પ્રમાણા (એચ.બી.એલ ક્રોકેસ્ટેન્ટો) | ૧૩૦ મિ.ગા. / એચ.બી.એલ. કરતા એચ.બી.એલ. વધુ |
| ગાયબિટીસ મેલાઇટસ | ૩૫ મિ.ગા. / એચ.બી.એલ. કરતા એચ.બી.એલ. ઓછું |
| નાની ટુંડ્રા હૃદયની ધમનીનો રોગ બાબતમાં કુંઠણન હાલિયસના વ્યાખ્યા : પહેલી શ્રેણીના પુરુષ સંખ્યા (ધ્વા, પિતા અથવા ભાઈ) જેઓ ૫૫ વર્ષથી ઓછી અંદર ટુંડ્રા હૃદયરોગના કાર્ય મૂલ્ય પાણી હોય, અથવા પહેલી શ્રેણીની સ્થી સંખ્યા (ધ્વા, માતા અથવા બહેન) જેઓ દ્વારા હૃદયરોગના કાર્ય મૂલ્ય પાણી હોય. | નાની ટુંડ્રા હૃદયની ધમનીનો રોગ બાબતમાં કુંઠણન હાલિયસના વ્યાખ્યા : પહેલી શ્રેણીના પુરુષ સંખ્યા (ધ્વા, પિતા અથવા ભાઈ) જેઓ ૫૫ વર્ષથી ઓછી અંદર ટુંડ્રા હૃદયરોગના કાર્ય મૂલ્ય પાણી હોય, અથવા પહેલી શ્રેણીની સ્થી સંખ્યા (ધ્વા, માતા અથવા બહેન) જેઓ દ્વારા હૃદયરોગના કાર્ય મૂલ્ય પાણી હોય. |

હૃદયરોગ કોને થઈ શકે?

જો તમને અથવા તમારી સાથેના કોઈને છાતીમાં ગભરામણ થની હોય, ખાસ કરીને એક અથવા વધુ અન્ય લક્ષણો સાથે, તો થોડી મિનિટોથી વધુ વિલંબ ન કરવો (પાંચ મિનિટોથી વધારે તો કયારેય નહીં) તરત જ કોઈને મદદ માટે બોલાવો અને તાત્કાલિક હૉસ્પિટલે પહોંચો જાઓ.

જો તમને પોતાને દુઃખાવો થનો હોય, અને એમધ્યુલન્સ બોલાવી શકો તેમ ન હો, તો કોઈ તમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જાય તેની વ્યવસ્થા કરો. મહેરબાની કરીને જાતે વાહન ચલાવીને ન જવું, સિવાય કે બીજો કોઈ જ રસ્તો ન હોય.

‘જુઓ પટેલસાહેબ,’ ડોક્ટરે કંબું, ‘તમારા માટે “સર્વોત્તમ સલાહ” એ છે કે તમે સિગારેટ અને તમારું બંધ કરો. દારૂ પીવાનું બંધ રાખો અને ચરબીવાળો ખોરાક ન લો.’

‘સર્વોત્તમ સલાહ મારે નથી જોઈતી, પણ બીજા નંબરની ઉત્તમ સલાહ આપો.’



જડપભેર સારવાર કઈ રીતે શરૂ કરવી?

હદયરોગના હુમલાને ઓળખનાં શીખી લેવું અને તાબડતોડ સુસજજ હોસ્પિટલ જવું. તે તાત્કાલિક સારવાર મેળવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. આમ કરવા માટે હદયરોગનાં સામાન્ય લક્ષણો વિશે ઘરની સર્વે વ્યક્તિઓને માહિતી હોવી જ જોઈએ. દર્દી પોતે, તેનાં પતિ/પત્ની, સગાં-સંબંધી, મિત્રો, ઇન્મિલી ડૉક્ટર, હોસ્પિટલ અને હદયરોગ નિષ્ગાતે મળીને એક ટીમ બનાવવી જોઈએ, જેથી કરીને દર્દીને સર્વશ્રેષ્ઠ સારવાર મળે.

ધ્યાન વખત અમે હદયરોગના તીવ્ર હુમલાવાળા દર્દીને સારામાં સારી સારવાર આપી શક્યા છીએ તો ફક્ત એટલા જ કારણસર કે તે દર્દીને સમયસર અમારી પાસે લાવવામાં આવ્યા હતા.

આ થવાનું કારણ એ હતું કે દર્દી અને તેને ટેકો આપનાર લોકો હદયરોગ હુમલાનાં લક્ષણો અને નિશાનીઓથી અને હુમલો આવે ત્યારે શું કરવું તેનાથી પરિચિત હતા. તે ઉપરાંત હોસ્પિટલ કટોક્ટીની હાલતવાળા દર્દીની સારવાર કરવા માટે તૈયાર સ્થિતિમાં હતી.

પહેલો એક કલાક

સંશોધન દ્વારા જાગુવા મળ્યું છે કે હદયરોગના હુમલાથી થતા મોટાભાગના મૃત્યુ છાતીમાં દુખાવો થાય ત્યાર પછીના પહેલા કલાકમાં જ થાય છે. પણ જો લોહી ન પહોંચતું હોય તેવા હદયના સ્નાયુના ભાગને થોડી જ વારમાં

લોહી આપવામાં આવે, તો તે ખામી વગર ફરીથી તદ્દન સ્વસ્થ થઈ જાય છે. એટલે હદયરોગના હુમલાની સર્વોત્તમ સારવાર



જેટલી વહેલી મળે એટલી સારી.

તમને અથવા કોઈને હદયરોગનો હુમલો આવ્યો છે તેવી શંકા હોય તો ડૉક્ટરને ઘરે બોલાવવાથી કિંમતી સમય બરબાદ થાય છે અને સમયની બરબાદીના હિસાબે મૃત્યુ પણ થઈ શકે છે. એટલે હદયરોગના હુમલા પછીની સર્વોત્તમ સારવાર માટે પૂરેપૂરી સુવિધા હોય તેવી નજીકની હોસ્પિટલમાં જલદીમાં પહોંચી જવું જોઈએ.

હદયરોગનો શાંત હુમલો

ધ્યાબિટીસના દર્દીને હદયરોગનો હુમલો આવે ત્યારે દુખાવો ન થાય તેનું બની શકે. તેમને કદાચ કોઈ જ લક્ષણ ન અનુભવાય અથવા તો થોડો શ્વાસ ચેતે અથવા પસીનો વળે, અથવા ખૂબ જ નબળાઈ લાગે. આ પ્રકારના કિસ્સાઓનો ખ્યાલ ન આવે અને તેની સારવાર ન થાય એવું બને, કારણ કે ઘણા લોકો આવાં સામાન્ય લક્ષણોને ધ્યાનમાં ન લે.

હદયરોગના હુમલામાં શું કરવું?

જે પણ કામ કરતા હોય તે બંધ કરીને આરામ કરો. ઓગળી શકે તેવી એસ્પિરિનની એક ગોળી લો. તેનાથી લોહી પાતળું થઈ જાય છે અને તેને જામતું અટકાવે છે. એસ્પિરિનની એક ગોળી લેવી એ હદયના હુમલા માટે ઘરે થઈ શકે તેમાં સૌથી સારો ઈલાજ છે. નાઈટ્રોલિસિનની એક ગોળી જ્ઞમની નીચે મૂકી દો. તરત મદદ માંગો અને એમ્યુલન્સ બોલાવો.

તમારા ડૉક્ટરને ઘેર બોલાવવાથી કિંમતી સમય બરબાદ થાય છે. ફોન પર તમારા ડૉક્ટરને તકલીફની વાત કરીને તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જાઓ. ઓગળી શકે તેવી એસ્પિરિન લેવી તે સૌથી મહત્વનું છે, જે જ્યું બચાવી શકે છે અને જ્યારે પણ તમને પોતાને હદયરોગનો હુમલો થયો હોવાની શંકા જાય ત્યારે તમે એસ્પિરિન લઈ શકો છો.



એક દિવસ ડૉક્ટર એક દર્દીના લોબોરેટરી રિપોર્ટ જોઈ ચમક્યા. દર્દીનું ક્રોલેસ્ટેરોલ ખૂબ વધારે હતું. બ્લડપ્રેશર પણ ખૂબ ઊંચું હતું, ધાયાબિટીસ બેકાબૂ હતો. ડૉક્ટરને ફોન જોડ્યો, ‘તમારા પતિના લેબ રિપોર્ટ આવી ગયા છે અને તે બધું જ ખરાબ છે.’

એમને મળતાં પહેલાં હું તમને એ કહેવા માંગ્યું હું ક તમે મારી સલાહનું પૂરેપૂરુષ પાલન નહીં કરો તો એ છ માસમાં ગુજરી જશે.’ ‘હું એમના માટે શું કરું ડૉક્ટર?’ દર્દીના પત્નીએ પૂછ્યું.

‘એમની જિંદગીમાંથી તાજાવના બધાં કારણો કાઢી નાંખો.’ ડૉક્ટરે કહ્યું. ‘ધર એકદમ ચોખ્યું રાખો. એમને માટે ત્રણ વખત પૌસ્ટિક રસોઈ બનાવો અને ખૂબ પ્રેમ આપો.’

એ બહેને ફોન મૂકી દીધો અને પતિને કહ્યું, “ડૉક્ટરનો ફોન હતો.”

‘શું કરું એમણો?’ ‘કહેતા હતા કે તમે છ મહિના પણ નહીં ખેચો!’



૬૦ ટકા બંધ ધમની

આપી શકાય.

વારંવાર ઈ.સી.જી. નોંધાવાથી હૃદયરોગના હુમલામાં થતી પ્રગતિ વિશે ડૉક્ટરોને ખબર પડે. એની સાથે ટ્રોપોનિન અથવા સી.પી.કે. એન્જાઈમ જેવી લોહીની તપાસ કરવામાં આવે છે કારણ એ પણ હૃદયરોગના હુમલાની પ્રગતિ વિશેનો આગુસાર આપે છે.



એન્જિયોપ્લાસ્ટી પણી
પૂરેપરી ખૂલ્લી ધમની

પ્રાઈમરી એન્જિયોપ્લાસ્ટી

જો દર્દને સમયસર દાખલ કરવામાં આવ્યો હોય તો હૃદયરોગના હુમલાની સારવારમાં સામાન્ય રીતે પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

આ ‘પ્રોસ્ટ્રાન્ડ’માં જાંધની ધમનીમાં કાણું પાડીને તેમાં નાનકડા ફુગગાવાળા કંથેટરને પસાર કરવામાં આવે છે. આ કંથેટરને ત્યાંથી હૃદયની કોરોનરી



ધમનીઓની અંદર પસાર કરવામાં આવે છે.

પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટીમાં જે કોરોનરી ધમની/ધમનીઓમાં અવરોધ આવ્યો હોય, તેને તરત જ ખોલી નાંખવામાં આવે છે. આ સારવારનો ફ્લાયર્સ એ છે કે લોહીના પુરવઠાથી વંચિત રહેવાના કારણે હૃદયના સ્નાયુમાં

નુકસાન થતું રોકી શકાય છે. તેમજ આવી પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી વખતે એન્જિયોગ્રામમાંથી એ પણ જાળી શકાય છે કે બંધ થયેલી ધમની ખૂલ્લી છે કે નહીં.

હૃદયરોગના હુમલા પછી તરત જ એન્જિયોપ્લાસ્ટી કરવી એને દુનિયાભરમાં હાર્ટ એટેકની સર્વશ્રેષ્ઠ સારવાર તરીકે સ્વીકારવામાં આવી છે.

પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી અંગેનો નિર્ણય

હૃદયરોગના હુમલામાં પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી એ શ્રેષ્ઠ સારવાર છે ખરી, પણ દર્દી, તેનાં પતિ/પત્ની અને સગાં-સંબંધીઓને કટોકટીની પરિસ્થિતિમાં પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી કે નહીં તેનો અતિશય અગત્યનો નિર્ણય લેવાનો હોય છે.

પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી જેવી મોટી હસ્તક્ષેપ કિયા (Interventional Procedure) કરવા માટે કટોકટીની પરિસ્થિતિમાં હા'પાડવી કે નહિ એ નક્કી કરવામાં કદાચ એક વાત મદદરૂપ બને. હૃદયરોગના હુમલાના

મોટાભાગના કિસ્સાઓમાં વહેલીમોતી કયારેક તો તપાસ માટે એન્જિયોગ્રાહી કરવી જ પડે છે. એટલે એવું સમજવું કે કયારેક એન્જિયોગ્રાહી કરીએ તેના બદલામાં તાત્કાલિક એન્જિયોગ્રાહી અને આવશ્યક લાગે તો એન્જિયોપ્લાસ્ટી કેમ ના કરાવી લઈએ? તાત્કાલિક એન્જિયોગ્રાહી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાથી હૃદયને ઓછામાં ઓછું નુકસાન પહોંચે અને વધારાનો ફ્લાયર્સ મળશે.

તાત્પર્ય: તાત્કાલિક પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરાવી લેવી સલાહભર્યું છે.

પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી એવી હોસ્પિટલમાં જ થવી જોઈએ, જ્યાં સામાન્ય રીતે પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી થતી હોય. તેમજ અનેક પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરવાનો અનુભવ ધરવતાં કુશળ હૃદયરોગ નિષ્ગત પાસે જ પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી જોઈએ.

શ્રોભોલાઈસિસ (જામેલા લોહીને ઓગાળવાની કિયા)

જે લોકો કોઈ પણ કારણસર પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી કરાવી શકે તેમ ન હોય તેમનું શું? એવા સંજોગોમાં જામેલા લોહીના ગણ્ણાને ઓગાળી શકતા સ્ટ્રેટોકાઇનેજ અને યુરોકાઇનેજ જેવા ચેન્જાઈમ નસો વાટે આપવામાં આવે છે. આ એન્જાઈમ જામેલા લોહીને ઓગાળી શકે છે, પણ કમનસીબે તે ફ્રીટ 60 ટકા કિસ્સાઓમાં જ અસરકારક બને છે. એક વખત આદર્શ સારવાર શરૂ થઈ જાય, એટલે દર્દીનો જાન પ્રમાણમાં સુરક્ષિત થઈ જાય છે.

હૃદયરોગના હુમલા પછી બીજી બીમારીઓ લાગવાની શક્યતા હોય છે. સામાન્ય રીતે હૃદય નબળું પડી જવું, ફીરીથી હૃદયરોગનો હુમલો આવવો, અથવા હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા (અરોધમિયા) વગેરે જેવી તકલીફોનો ઠિલાજ તાત્કાલિક યોગ્ય સારવાર મળવાથી થઈ શકે છે.

સ્વાસ્થ્ય સ્થિર થયા પછી દર્દીને આઈ.સી.સી.યુ.ની બહાર લાવી શકાય છે. અને તેની હાલતને ધ્યાનમાં રાખીને થોડા દિવસમાં રજા આપી શકાય છે. પાછળથી પણ દર્દીને એન્જિયોગ્રાહીની જરૂર પડી શકે.

હૃદયરોગના હુમલા પછી

હૃદયરોગ નિષ્ગતને દર્દીની સ્થિતિ સ્થિર લાગે એ પછી જ તેઓ દર્દીને ઘરે મોકલે છે.

2-3 દિવસ સુધી આરામ અને વિશ્વામ જરૂરી છે.

હૃદયરોગના હુમલાની તીવ્રતાને ધ્યાનમાં લઈને ધીમે ધીમે ૬૬% દર્દી તો નાંં રોજબરોજનાં કાર્યોની



શરૂઆત કરી શકે અને કસરત પાણ કરી શકે. દર્દીને 7 થી 10 દિવસમાં ચાલવા અને થોડુંક કામ કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી

નાહવા અને તૈથાર થવા જેવાં બધાં જ અંગત કાર્યો જાતે કરી શકાય. તેમ છતાં, કદાચ જરૂર પડી શકે તે વાત ધ્યાનમાં રાખીને કોઈને નજીકમાં રાખવું જોઈએ.

જિંદગી ખરેખર ૪૦માં વર્ષ શરૂ થાય છે. પણ કમનસીને એ જ ઉમરે સંધિવા, હદ્યરોગ અને ગ્રોસ્ટેટની બિમારી વગેરે પણ શરૂ થાય છે!

સંંગસ કરવા માટે બેઝપેન (પલંગ પર સૂતાં-સૂતાં સંંગસ કરવા માટેનું પાત્ર)નો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે અગવડભર્યું છે અને અસાધારણ સિથિતમાં મળ પસાર કરવા માટે જોર પાડે છે, અને તેનાથી લોહીનું દબાગું વધી શકે. પલંગની નજીક બેઠકવાનું જાજર વાપરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી કમોડ (બેઠકવાનું જાજર) વાપરવું હિતાવહ છે. ઊભડક બેસવું પડે તેવું જાજર ઓછું વાપરવું જોઈએ.



એક અઠવાડિયા પછી

ડૉક્ટરનો અભિપ્રાય લીધા પછી થોડું થોડું ચાલી શકાય, અને ધીમે ધીમે અંતર વધારી શકાય (જેમ કે ધણા ડૉક્ટરો એકની એક ભૂલ ૨૦થી ૨૫ વખત કરે છે અને તેને અનુભવ કરે છે).

દાદરા ચઢવાનું ચાલુ કરો. શરૂઆત 2-3 દાદરાથી કરો. ભારે વજન ન ભંચકવું. જમ્યા પછી 2-3 કલાક સુધી કસરત ન કરવી. હોસ્પિટલમાંથી રજા મળો, તે પછીના લગભગ ચાર અઠવાડિયાંમાં ધીરે ધીરે બધું કામ કરી શકાય, પણ તે સમયગાળો હદ્યરોગના હુમલાની તીવ્રતા ઉપર આધારિત છે. જેને એન્જિયોલાસ્ટી અથવા બાયપાસ શસ્ત્રકર્જિયા કરવામાં આવી હોય, તેવા દર્દીઓ તો અઠવાડિયા પછી એકાદ કિ.ભી.થી વધુ ચાલી શકે.



સૌજન્ય 'હદ્યની વાત દિલથી' - લેખક : ડૉ. કેયુર પરીખ

**Blood
Donation Camp**

રક્તદાન કરો.
જીવનદાતા બનો.



હાર્ટ એટેક



તમને હાર્ટ એટેક આવ્યો છે એવું લાગે છે

ત્યારે ગકપ
થી ૧૦૮
પર લોન કરો



Courtesy :

CardioSmart
American College of Cardiology

24 x 7

જ્યારે ઈમરજન્સી હોય, ત્યારે સીમ્સ જ
ઈમરજન્સી : +91 - 97234 50000 | એમ્યુલન્સ : +91- 98244 50000

મેડીકલ હેલ્પલાઇન : +91-70 69 00 00 00

સીમ્સ હોસ્પિટલ, અમદાવાદ, ખાતો

ત્રણ દિવસ બલડ ડોનેશન કેમ્પનું આચ્યોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધણા લોકોએ રક્તદાન કર્યું,

અમૃત્યુ રક્તદાન કરનાર દાતાનો અમે હદ્યપૂર્વક આભાર માનીએ છીએ

સીમ્સ હોસ્પિટલ મેડિકલ ટીમમાં નવા ડૉક્ટરનો સમાવિષ્ટ

સીમ્સ કેન્સરમાં
નવા ડૉક્ટરનો સમાવિષ્ટ



ડૉ. મહાવીર તાડાઈયા

MBBS, MS, M.Ch

ઓન્કો સર્જન

મો. +91 99099 27664
mahavir.tadaiya@cimshospital.org

સીમ્સ ઓર્થોપેડીકમાં નવા ડૉક્ટરનો સમાવિષ્ટ



ડૉ. પાર્થ પારેખ

MBBS, DNB

Consultant Orthopaedic
Foot & Ankle Surgeon

મો. +91 97123 00124
parth.parekh@cimshospital.org



ડૉ. પ્રવીણ સારદા

FRCS (Trauma & Orthopaedics), UK
Fellow, European Board of
Orthopaedics and Traumatology (EBOT)

MBBS, MS (Ortho),

Dip. SICOT (Gold Medalist)

ઓર્થોપેડીક સર્જન (ખબો અને કોણી)

મો. +91 77420 89371
praveen.sarda@cimshospital.org

સીમ્સ ન્યૂરો સર્જરીમાં
નવા ડૉક્ટરનો સમાવિષ્ટ



ડૉ. પ્રશાંત પટેલ

MBBS, MS, DNB (Neuro Surgery)
M.Ch (Neuro Surgery)

ન્યૂરો સર્જન

મો. +91 98254 55595
prashant.patel@cimshospital.org

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો : +91 98250 66661, +91-79-3010 1008

સીમ્સ ન્યૂરોસાયન્સ



દર્દ સામે ઝુકશો નહીં

સુરક્ષિત સ્પાઈન સર્જરી - સીમ્સ હોસ્પિટલ

આશારે ૪૫% લોકો પીઠના દુખાવા ને ૭ અંદવાડિયા સુધી ધ્યાનમાં લેતા નથી, જેના કારણે સારવાર મોડી થાય છે.

અપોઇન્ટમેન્ટ માટે +91-79-3010 1008

મોબાઇલ : +91-98250 66661

સીમ્સ ઓર્થોપેડીકસ

નાનું પરિવર્તન, મોટો ફેરફાર

ઓર્થોપેડીકસ ની સમસ્યાઓથી બચો

- સ્વસ્થ વજન જાળવી રાખો
- વધારે માં વધારે ચાલો
- યોગ્ય જૂતા પહેરો
- નિયમિત સ્વાસ્થ્ય ની તપાસ કરાઓ



અપોઇન્ટમેન્ટ માટે +91-79-3010 1008 | મોબાઇલ : +91-98250 66661

સીમ્સ હોસ્પિટલ

જયારે ઈમરજન્સી, ત્યારે સીમ્સ
યોગ્ય સારવાર, ઝડપી સારવાર



કોઈપણ પ્રકારની વાતકાલિક સારવાર માટે 24 X 7 ઉપલબ્ધ

ગુજરાતની સૌથી મોટી ઈમરજન્સી ટીમ માંની એક

| ઓર્થો - ટ્રોમા અને પોલી ટ્રોમા | ન્યૂરો સર્જરી | કિંડીકલ કેર | વાક્યુલર અને થોરાસીસ સર્જરી | મેડિસલોફેશીયલ અને પ્યાસ્ટ્રીક સર્જરી | જનરલ સર્જરી અને એંડોમીનિલ ટ્રોમા |
|---|---|---|--|--|---|
| ડૉ. પ્રણાવ એ. શાહ ડૉ. કૃષ્ણાલ પટેલ ડૉ. સમીપ શેઠ | ડૉ. દેવેન જઘેરી ડૉ. ટી.કે.બી. ગણપથી ડૉ. પ્રશાંત પટેલ ડૉ. પૂર્વ પટેલ (વિઝીર્ટા) | ડૉ. ભાગ્યેશ શાહ ડૉ. વિપુલ છક્કર ડૉ. ગૌતમ પ્રજાપતિ | ડૉ. પ્રણાવ મોદી ડૉ. સૃજલ શાહ (વિઝીર્ટા) ઇન્ફેક્શન્સ ડિસ્ટ્રિક્શન ડૉ. સુરલી મદન | ડૉ. વલ્સાલ કોઠારી ડૉ. રીધમ મહેતા ડૉ. અંકિતા મીટા | ડૉ. જુગાર શાહ ડૉ. ચિરાગ શાહ ડૉ. મનિપ ગાંધી (ડૉ. સર્જરી) |

એમ્યુલન્સ : +91-98 24 45 00 00 | ઈમરજન્સી : +91-97 23 45 00 00 | 24 X 7 મેડિકલ હેલ્પ લાર્ડન +91-70 69 00 00 00



બેસ્ટ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ
ઓફ દ ઈચ્ચર ૨૦૧૬, ગુજરાત



સિમ્સ હોસ્પિટલ (NABH અને JCI-International Gold Seal પ્રમાણિત) ને 4th ઇન્ટરનેશનલ હેલ્પ્યુકેર એવોર્ડ એન્ડ કોન્ફરન્સ-૨૦૧૬ માં બેસ્ટ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ઓફ દ ઈચ્ચર ૨૦૧૬, ગુજરાત ને એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા છે, સુપરસિદ્ધ કિકેટર શ્રી સુનીલ ગાવસ્કર ના હાથ થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અમે આ પુરસ્કારને અમારા દર્દીઓના વિશ્વાસ અને અમારા સિમ્સ પરિવારને નિર્ણાર્થ ભાવને સમર્પિત કરીએ છીએ.

"Maru Hriday" Registered under RNI No. GUJGUJ/2009/28044

Published 15th of every month

Permitted to post at PSO, Ahmedabad-380002 on the 22nd to 27th of every month under
Postal Registration No. GAMC-1731/2019-2021 issued by SSP Ahmedabad valid upto 31st December, 2021
Licence to Post Without Prepayment No. PMG/HQ/090/2019-2021 valid upto 31st December, 2021

If undelivered Please Return to :

CIMS Hospital, Nr. Shukan Mall,
Off Science City Road, Sola, Ahmedabad-380060.
Ph. : +91-79-2771 2771-72
Fax: +91-79-2771 2770
Mobile : +91-98250 66664, 98250 66668

'મારુ હ્રદય' નો અંક મેળવવા અંગો : જો તમારે 'મારુ હ્રદય' નો અંક જોઈતો હોય તો તેની કિંમત રૂ ૬૦ (૧૨ અંક) છે. તેને મેળવવા માટે કેશ અથવા ચેક/ડિડી 'સીમ્સ હોસ્પિટલ પ્રા. લી.' ના નામનો તમારા નામ અને તમારા પુરતા એન્ડ્રેસની વિગત સાથે અમારી ઓફિસ, "મારુ હ્રદય" ડિપાર્ટમેન્ટ, સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજીક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ પર મોકલી આપશો. ફોન નં. : +૯૧-૭૯-૩૦૧૦ ૧૦૫૮/૧૦૬૦

Care At Homes®

home health @ your doorstep

A UNIT OF CIMS HOSPITAL PVT LTD

હેલ્થ ને પરંપરા કરો, આરામ કરો

તમારા હેલ્થ માટે શ્રેષ્ઠ પેકેજ પરંપરા કરો



દર્દીની સંપૂર્ણ
માહિતી ફક્ત એક જ
કિલકમાં મળશે.

નાહિનીનું
નાહિની

₹ 2,999

₹ 5,000

નર્સ : સાયાહિક બિઝીટ
ડૉક્ટર : મહિનામાં એક વાર

₹ 4,999

₹ 8,000

નર્સ : સાયાહિક બિઝીટ
ડૉક્ટર : મહિનામાં એક વાર
કપલ પેકેજ

₹ 10,999

₹ 21,998

નર્સ : ૨ બિઝીટ મહિનાની

₹ 19,999

₹ 39,998

નર્સ : ૨ બિઝીટ મહિનાની
ડૉક્ટર : ૧ બિઝીટ
(૬૨ ર મહિનાને)

₹ 29,999

₹ 59,998

નર્સ : ૨ બિઝીટ મહિનાની
ડૉક્ટર : ૧ બિઝીટ મહિનાની

ડૉક્ટર બિઝીટ

- દર્દીનું પરીક્ષણ સાથે વાઈટલ તપાસ
- (બી.પી., ધબકારા, ઓક્સિજન, તાપમાન, સુગર)
- સારવાર કરી રહેલ ડૉક્ટરને દર્દીની સ્વાસ્થ્ય અંગો માહિતીગાર કરવામાં આવશે

નર્સ બિઝીટ

- વાઈટલ તપાસ (બી.પી., ધબકારા, ઓક્સિજન, તાપમાન, સુગર)
- પીલ બોક્સમાં દવા રીફીલ કરવી (૬૨ ૭/૧૫ દિવસોમાં)
- સારવાર કરી રહેલ ડૉક્ટરને દર્દીની સ્વાસ્થ્ય અંગો માહિતીગાર કરવામાં આવશે

ફિઝીયોથેરાપી બિઝીટ

- ફિઝીયોથેરાપીની સેવાઓ ધરબેઠા મેળવો

ડાયટીશીયન બિઝીટ

- પોષણયુક્ત ખોરાક માટેની જાણકારી તથા તેને લગતા પ્રશ્નોની માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

ધરબેઠા દવાઓ મેળવો

- ગુણવત્તા યુક્ત દવાઓ
- દવાઓ અને મેડિકલ સાધનો, દર્દી અને દર્દીના સગા-સંબંધીઓ માટે ડિસ્કાઉન્ટમાં મળશે. કોઈ ડિલીવરી ચાર્જ વગાર

ધરબેઠા બલડ (રકતા) ની તપાસ

- બલડ (રકતા) ની તપાસ, દર્દી અને દર્દીના સગા-સંબંધીઓ માટે ડિસ્કાઉન્ટમાં મળશે. બલડ કલેક્શન કોઈપણ ચાર્જ વગાર

તમામ દર્દીના રીપોર્ટ અને દર્દીની કંડીશન નિયમિત પણે જાણ કરવામાં આવશે.

ઓફર માગ પ્રથમ ૧૦૦ રૂપાઈશે.

ફિઝીયોથેરાપીસ્ટ અને ડાયટીશીયન બિઝીટ બધા પેકેજમાં નિઃશુલ્ક છે.*

*શરતો આપિન

વધુ જાણકારી માટે : +91-79-3010 2326 (M) +91-90990 67988

દર્દી હંમેશા પહેલા

નાની, મુદ્રક અને પ્રકાશક ડૉ. અનિશ ચંદ્રચાણાએ સીમ્સ હોસ્પિટલ વતી હારિઓમ પ્રિન્ટરી, ૧૫/૧, નાગોરી એસ્ટેટ,

ઇ.એસ.આઇ. ડિસ્પેન્સરીની સામે, દૂરેચાર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૪ ખાતેથી છાયું અને

સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજીક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ ખાતેથી પ્રસિદ્ધ કર્યું.